॥ સનાતન પરમો ધર્મ ॥

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું મુખપત્ર

સોસીયલ મિડીયા

પ્રચાર પ્રસાર જાગૃત ઉજાગર

સનાતન ધર્મ પત્રિકા

FOR MEMBERS INTERNAL CIRCULAR

સં -૨૦૮૦ | મહા સુદ - ૧૩ | તા.૨૨-૦૨ -૨૦૨૪ | ગુરુવાર | SDP No.: 1399 MOB.:+91 7801877774, +91 7718977774 | ankasantandharmpatrika@gmail.com

નાશિક સમાજ નાશિકરોડ વિભાગ માં સનાતન કપ-૨૦૨૪ બોક્ષ ક્રિકેટનું ભવ્ય આયોજન

દિપ પ્રાગટ્ય

નાસિકરોડ : અત્રેના શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન પરિવાર -નાસિકરોડ તેમજ સનાતન યુવા મંડળ દ્વારા

"સનાતન કપ- 2024 "યુવાનો અને મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું તા.18-2-2024 ના રોજ બિરલા ઓપન માઈન્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ ના ટર્ફ મેદાન પર- નાસિક રોડ ખાતે સફળતાપૂર્વક થઈ ગયું. જેમાં કુલ યુવાનોની 8 ટીમો અને મહિલાઓની 3 ટીમો અને અંડર 18 ની 3 ટીમો માં 112 ખેલાડીઓએ ભાગ લીધેલ. સનાતન સમાજના પ્રમુખ તેમજ નાશિક સમાજના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ નાકરાણીઅને અન્ય મહાનુભાવો ની હાજરીમાં દિપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટને ખુલી મુકેલ.

આ ટુર્નામેન્ટમાં આયોજકોના આમંત્રણ ને માન આપી મધ્ય મહારાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ શ્રી શરદભાઈમાવાણી, ખંડ પ્રભારી શ્રી ખેતસી ભાઈ રવાણી,નાશિક સમાજના મંત્રી શ્રી હસમુખભાઈ છાભૈયા, નાસિક સમાજના ટ્રસ્ટી અને ખજાનચી શ્રી દિલીપભાઈ પોકાર, નાસિક સમાજના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ વાસાણી, શ્રી અજીતભાઈ પોકાર, નાસિક સમાજના માજી ટ્રસ્ટી શ્રી ધીરજભાઈ ધોળું, કાંતિભાઈ ભાદાણી, નાશિક યુવા મંડળના પ્રમુખ શ્રી ચેતનભાઈ માવાણી, યુવા મંડળ, યુવાસંઘના હોદેદારો તથા સભ્યો એ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારેલ.

આ ટુર્નામેન્ટમાં મહિલાઓની ટીમો માં સ્પાર્ક એવેન્જર્સ વિજેતા ટીમ રહી હતી. વિરાંગના(પરિમલ રોયલ્સ) ઉપવિજેતા ટીમ રહી હતી. વુમન ઓફ ધ સીરીઝ ધ્વનિ સેગાણી (39 રન, 5 વિકેટ), બેસ્ટ વુમન બેસ્ટ મેન દિવ્યા ભગત(54 રન),બેસ્ટ બોલર ધ્વની સેગાણી(5 વિકેટ),મેન ઓફ ધ મેચ ફાઇનલ દિવ્યા ભગત (20 રન). અંડર 18 માં પવિત્ર વોરિયર્સ વિજેતા ટીમ અને માકાણી રોયલ્સ ઉપવિજેતા ટીમ રહી હતી. યુવાનો ની ટીમો માં પરિમલ રોયલ્સ વિજેતા ટીમ, DSP વોરિયર્સ ઉપવિજેતા ટીમ રહી હતી. મેન ઓફ ધ સીરીઝ લવેશ પોકાર(149 રન, 4 વિકેટ), બેસ્ટ બેસ્ટ મેન લવેશ પોકાર (149 રન),બેસ્ટ બોલર જીગ્નેશ રામાણી (7 વિકેટ), મેન ઓફ ધ મેચ ફાઇનલ ક્રિષ્ના ચોપડા (3 વિકેટ),મેન ઓફ ધ મેચ 1- રોનક પોકાર (38 રન), 2- જીગ્નેશ રામાણી(17 રન,1 વિકેટ)

સ્પોર્ટ્સ કન્વીનર તરીકે યસ માવાણી, ચિરાગ સેઘાણી, પૂજ્ય ભીમાણી, વૈભવ નાકરાણી, સાગર ભગત હતા. સનાતન યુવા મંડળ પ્રમુખ શ્રી કિરીટભાઈ ચોપડા, ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ચૌહાણ, વિનોદભાઈ ભગત, મંત્રી શ્રી ધીરજભાઈ માકાણી,સહમંત્રી શ્રી જય રંગાણી, તેમજ વિપુલ પચાણી, અંકુર ભગત, ધવલ પોકાર, રોનક પોકાર, હિતેશ પોકાર, વિનોદ લીંબાણી, લવેશ પોકાર, કાર્તિક

યુવાનો ની વિજેતા ટીમ - પરિમલ રોયલ્સ

ચોપડા તેમજ યુવા મંડળના ભાઈઓએ ટુર્નામેન્ટને સફળ બનાવેલ. ટુર્નામેન્ટ નું સંચાલન મંત્રી શ્રી ભરતભાઈ ચોપડાએ કરેલ.

યુવાનોના સનાતન કપ ના સ્પોન્સર અનુપ બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ તથા હળપાણી બિલ્ડકોન અને મહિલાઓના સનાતન કપના સ્પોન્સર સહેજ બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ LLP તથા આધ્યા કન્સ્ટ્રક્શન હતા. આ ઉપરાંત અન્ય દાતાશ્રીઓ એ આર્થિક સહયોગ આપેલ. સનાતન પરિવારના પ્રમુખશ્રી દિનેશભાઈ નાકરાણી એ ટુર્નામેન્ટમાં સહકાર આપનાર સર્વેદાતાઓ તથા કાર્યકર્તાઓને અભિનંદન આપેલ.

સંયોજક :
રમેશ ડી વાસાણી, નાશિક.

મહિલા ની વિજેતા ટીમ - સ્પાર્ક એવેન્જર્સ

અંડર 18 ની વિજેતા ટીમ - પવિત્ર વોરિયર્સ

નરેન્દ્ર ભાદાણી (GPSC) પરીક્ષા ઉત્તીર્ણ કરી ગુજરાત સરકાર ક્લાસ-0૨ અધિકારી પદે નિમણૂક

આપણું સામાજિક ગૌરવ નરેન્દ્ર રવિલાલ નારણભાઈ ભાદાણી કચ્છમાં ગામ નખત્રાણા (નવાવાસ) નિવાસી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવેલ નર્મદા,જળ સંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (સિંચાઈ વિભાગ) Assistant Engineer Class-2 ની પરીક્ષામા સમગ્ર ગુજરાતમાં 15 મા ક્રમે પાસ થયાં છે અને ગુજરાત સરકારના Class-2 અધિકારી બની ગયા છે.સાથે થોડા સમય પહેલા જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ મ્યુનિસિપલ એન્જિનિયર (Civil) (super class-3) ની પરીક્ષામાં ગુજરાતમાં ૦૨ ક્રમે પાસ થયાં હતાં.

હાલમાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) મા class-3 Officer (Civil) તરીકે ફરજ પર કાર્યરત છે.પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારવા બદલ ટીમ પ્રચાર અને પ્રસાર સમિતિ નરેન્દ્રભાઈને અભિનંદન પાઠવે છે.

તેઓ ભવિષ્યમાં યુવાઓના માર્ગદર્શક સાથે પ્રેરણા સ્રોત બની સમાજનું ગૌરવ વધારતા રહે એવી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ...

નરેન્દ્ર ભાદાણી
M. 8866226489. 9879283592

૨૨।૦૨।૨૪ ગુરુવાર
નમો નારાયણાય શ્રીમદ્ ભગવદ્ ગીતા

ન ચૈતદ્ વિદ્મઃ કતરન્નો ગરીયઃ યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ।
યાનેવ હત્વા ન જિજીવિષામઃ તેડવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ॥
(અ.૨~૬)

વળી એ પણ અમે જાણતા નથી, કે યુદ્ધ યા ભિક્ષા બેમાંથી કયું અમારે માટે વધારે સારું છે?

અગર યુદ્ધમાં અમે જીતીયે અથવા અમને તેઓ જીતે તો પણ વ્યર્થ જ છે, કેમ કે જેમને હણીને અમે જીવવા પણ ઈચ્છતા નથી, તે કૌરવો અમારી સામે ઊભા છે.

વલ્લભકૃષ્ણના જય શ્રી લક્ષ્મીનારાયણ
જ્ઞાનદર્શક સંતશ્રી સંસ્કારધામ-કચ્છ

કૌસાની પ્રવાસ - મિશન અભિમન્યુ તીર્થાનંદ સારથિ ટીમ નો સુન્દર પ્રયાસ

બહુ જ ટૂંક સમયમાં મિશન અભિમન્યુ ના સર્વે સારથિઓ હેતુ તીર્થાનંદ રુપે પ્રવાસ આયોજિત થવા જઈ રહ્યો છે. જ્યાં મિશન સારથિઓ ના સંગાથ ના પ્રયોજન નિમિત્તે સર્વે ને રુબરુ મળવાનો એક સુઅવસર પ્રાપ્ત થવાનો છે.

મિશન મુખ્ય સંયોજક - નરેન્દ્ર ભાઈ ચૌધરી તથા કિશોર ભાઈ સાંખલા દ્વારા આ તીર્થાનંદ પ્રવાસ હેતુ કૌસાની-સ્થળ નો સુઝાવ આપવામાં આવેલ છે. ઉત્તરાખંડ ના આ સ્થળ - કૌસાની પર જૂન મહિનામાં પ્રવાસ ગોઠવવાનો વિચાર છે. કૌસાની - એક ખૂબ જ રમણીય સ્થળ છે,જે હિમાલય પર્વત ના ખોળામાં સ્થિત છે. સુન્દરતા થી ભરપૂર આ સ્થાન ને ભારત ના સ્વિટ્ઝર્લૅન્ડ ની ઉપમા આપવામાં આવે છે. હરિદ્વાર થી કૌસાની તથા કૌસાની થી હરિદ્વાર સુધી 4 દિવસ નો વ્યય રુ. 12000 નક્કી કરવામાં આવ્યો છે. (15 જૂન 2024 ના સવારે 5.00 વાગ્યે હરીદ્વાર થી કૌસાની, અને 18 જૂન 2024 ના રાત્રિ હરીદ્વાર રીટર્ન.)

કૌસાની - ઉત્તરાખંડના હિલ સ્ટેશન પર હિમાલયનો સુંદર નજારો જોવા મળે છે. દેશના ઘણા આધ્યાત્મિક રીતે સમૃદ્ધ સ્થાનો માંથી એક છે. એવું શુદ્ધ વાતાવરણ કે જ્યાં પ્રદૂષણ જરા પણ નથી. જ્યાં આપણે સકારાત્મક ઉર્જા ના પ્રવાહ ને અનુભવી શકીશું. તેમજ સ્વાધ્યાય હેતુ મનન - ચિંતન, સામૂહિક ધ્યાન તથા નવીન વિચારોના મંથન હેતુ ઉત્તમ સ્થાન છે.

આ ટૂરની વાસ્તવિક કિંમત ₹25,000 હશે પરંતુ મિશન અભિમન્યુ ની તીર્થાનંદ ટીમે ફક્ત ₹12,000 માં આ પ્રવાસ નું આયોજન કર્યું છે.

આ પ્રવાસ માં આપણા સનાતની સમાજના કોઈ પણ ભાઈ બહેન જોડાઈ શકે છે. સારથિ સંગાથ હેતુ યોજાયેલ તીર્થાનંદ કૌસાની પ્રવાસ ના માધ્યમ થી મિશન સારથિઓ ની મુલાકાત સંભવ બનશે તથા નવા વ્યક્તિઓ મિશન થી જોડાવા માટે પ્રેરિત થાશે. મિશન ને જાણવા તથા માણવા ના હેતુ થી.

તીર્થાનંદ પ્રવાસ હેતુ જે લોકો ના નામ ની નોંધ આવે છે તેઓ ને એક નવા ગ્રુપમાં એડ કરવામાં આવે છે.

જે વ્યક્તિઓ આવશે તેમણે ટૂર ના વ્યય ની અર્ધરાશિ અર્થાત ₹6000 રુ. જમા કરાવવા રહેશે. . તેના બાદ જ તેમણે એ નવા ગ્રુપમાં જોડવામાં આવશે તથા પ્રવાસ ની સર્વ પ્રકારની માહિતી આપવામાં આવશે. પ્રવાસમાં રહેઠાણ, જમણ, કાર્યક્રમ તથા સાઈડ સીન વગેરે.

આ વિશિષ્ટ પ્રવાસમાં સારથિઓ નો સંગાથ મહત્વનો છે, અતઃ કાર્યક્રમ પૂર્ણતઃ અનૌપચારિક રહેશે. કૌસાની સ્થાન ની સુન્દરતા નો ભરપૂર લાભ લેવા ના હેતુ થી આ કાર્યક્રમ ની રુપરેખા ખૂબ જ અલગ રુપમાં તૈયાર કરવામાં આવી છે. અતઃ મિશન ના કાર્યક્રમ ની રુપરેખા અંતર્ગત આવતી સર્વે ક્રિયાકલાપો ને પ્રકૃતિ સાથે જોડી ને માણીશું.

સર્વ આવનાર વ્યક્તિઓ ના પરસ્પર પરિચય સભા હોય, જ્ઞાનવર્ધક સંવાદ હોય, ધ્યાન પ્રણાલી હોય મનોરંજન ના પ્રોગ્રામ (ગેમ્સ, ટ્રેકિંગ તથા બોન ફાયર કેમ્પ) હોય ઈત્યાદિ... આ સર્વે ની રુપરેખા કોઈ પણ હૉલમાં ગોઠવવામાં નહીં આવે. બધું જ પ્રકૃતિ ના ખોળે માણવામાં આવશે.

25/02/2024 તારીખ સુધી 13 વર્ષ થી ઉપર કોઈ પણ સનાતની આ પ્રવાસ હેતુ પોતાનું નામ નોંધાવી શકે છે.

15 થી 18 જૂન 2024 - મિશન અભિમન્યુ તીર્થાનંદ કૌસાની પ્રવાસ ની પૂરી ડિઝાઇન જે પ્રમાણે તૈયાર કરી છે તે છે -

પ્રથમ દિવસ

15/06/2024 , સવારે 5.00 વાગ્યે હરિદ્વાર થી રવાના. ઋષિકેશ, દેવપ્રયાગ ,અલકનંદા - ભાગીરથી સંગમ, રુદ્રપ્રયાગ ધારીદેવી મંદિર, કરનપ્રયાગ, અદીબદરી, ગવાલડમ, કૌસાની - રાત રોકાણ.

બીજા દિવસ

આનાશક્તિ આશ્રમ, રુદ્રધારી વોટરફલો, સત્યનારાયણ બૈજનાથ, કોટ ભરમારી મંદિર, કીંપ ગાર્ડન, બોન ફાયર, મ્યુઝિક ડાન્સ.

ત્રીજા દિવસ

બાગદેશ્વર શહેર મંદિર, ટી ગાર્ડન, શાલ ફેક્ટરી, વૈદીક સ્કુલ અને પંચકરમ જેને ઈન્ટરેસ્ટ હોય, સ્ટાર ગેઝીંગ અને સાઇડશો, હિમાલય દર્શન.

ચોથા દિવસ

કૌસાની થી સોમેશ્વર, અલમોરા, નૈનિતાલ, કૈંચીધામ,ભીમતાલ,હલદ્વાની, કોરબેટ મ્યુઝિયમ, કાશીપુર, ધામપુર, હરીદ્વાર રીટર્ન. (આમાં સમયની અનુકૂળતા પ્રમાણે ફેરફાર આવી શકે છે.)

ઉપરોક્ત ઉલ્લેખ પ્રમાણે પ્રોગ્રામ ની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. પ્રવાસ સંબંધિત અન્ય વિશેષ જાણકારી હેતુ મિશન ના તીર્થાનંદ ટીમ ના સારથિ રંજન ભાવાણી : 8788172997 ને સંપર્ક કરવાનો રહેશે.

મિશન સારથિઓ ના ઉત્સાહ ને વધારવા માટે તથા નવા વ્યક્તિઓ ને મિશન થી જોડાણ હેતુ પ્રેરિત કરવાના આ સુન્દર પ્રયાસ બદલ મિશન અભિમન્યુ ની પૂરી ટીમ તીર્થાનંદ કૌસાની પ્રવાસ ના આયોજન ના ઉત્તરદાયી રંજન બેન ભાવાણી, (જલગાંવ) ફણિભૂષણ ભાઈ નાકરાણી (નાશિક) તથા ભાનુબેન નાકરાણી (નાશિક) ની આભારી છે.

હર ઘર અર્જુન - અભિમન્યુ
હર સમાજમાં મિશન અભિમન્યુ
પૂર્ણ મિશન અભિમન્યુ ટીમ સંગ
સંયોજક : નમિતા માધાણી, ગોવા.

રામ મંદિરના સૌથી મોટા ગુજરાતી કરોડપતિ દાનવીર બન્યા રાજ્યસભાનાં સાંસદ

પહેલી વખત રાજ્યસભાના સાંસદ બનેલા ગોવિંદભાઇ છેલ્લા ઘણા સમયથી હેડલાઇન્સમાં રહ્યા છે. અયોધ્યામાં બનેલા રામમંદિર માટે તેમણે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

રાજય સભાની ચૂંટણીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત 41 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના અન્ય 3 ઉમેદવારોને ગુજરાતમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

નડ્ડા સિવાય ભાજપાએ ડાયમંડ બિઝનેસમેન ગોવિંદભાઇ ધોળકિયા, ભાજપ નેતા જસવંતસિંહ પરમાર અને મયંક નાયકને રાજ્યસભામાં મોકલ્યા છે.

વિશ્વાબેન કૃપાલ સેંઘાણી, નડિયાદ CMA ઉત્તીર્ણ થયા

વડાગામ (અરવલ્લી) કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના અંબાલાલ મેઘજીભાઈ લીંબાણીની સુપુત્રી, નડિયાદના સેંઘાણી પરિવારની પુત્રવધૂ વિશ્વા કૃષાલકુમાર સેંઘાણી

પોતાના સંકલ્પ અને મહેનત થી હાલ માં The Institute of cost accountants of India નાં નેજા હેઠળ ડિસે.૨૦૨૩ માં લેવાયેલી CMA ની ગ્રુપ ૦૨ ની ફાઇનલ પરીક્ષા માં ૨૫૧ ગુણ સાથે ઉતીર્ણ થયેલ છે.

લગ્ન પછી ઘરની જવાબદારી અને ઘરના સભ્યોના સાથ સહકાર સાથે પોતાના સપનાઓને કેમ સાકાર કરવા તેનું ઉત્તમ ઉદાહરણ આપણી વિશ્વા દીકરીએ પૂરું પાડ્યું છે તે બદલ ખુબ ખુબ અભિનંદન.

CA/CS/CMA સનાતની પંચામૃત સંગઠન માં વિશ્વાનું સ્વાગત છે..યુવાસંઘ એજ્યુકેશન અને ટેલેન્ટ હન્ટ મિશન તેમનું અભિવાદન કરે છે...

યુવાસંઘ કચ્છ (પૂર્વ) રીજીયન અને શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર યુવક મંડળ દેશલપર (વાંઢાય) આયોજીત દુર્ગા ઈન્ફ્રા માઈનિંગ પ્રાઈવેટ લિમિટેડ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪ સુપર-૦૮ રાઉન્ડ

કચ્છ રીજીયન ટીમ નાં કર્ણધરો અને આયોજન કર્તાઓ સફળ રહેલ આયોજન સાથે ખુશી ની ઝલક

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ કચ્છ (પૂર્વ) રીજીયન તથા શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર યુવક મંડળ દેશલપર (વાંઢાય) દ્વારા આયોજીત દુર્ગા ઈન્ફ્રા માઈનિંગ પ્રાઈવેટ લિમિટેડ હસ્તે વડીલ સામજીભાઈ લઘાભાઈ ઘોળુ પરિવાર - દુર્ગાપુર હાલે વડોદરા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪ નો ભવ્ય થી ભવ્ય શુભારંભ તારીખ : ૦૭/૦૨/૨૦૨૪ ના રોજ લક્ષ્મીનારાયણ સંસ્કારધામ કેન્દ્રસ્થાન ગ્રાઉન્ડ - દેશલપર મધ્યે કરવામાં આવેલ હતો જેમાં હાલ માં સુપર ૦૮ રાઉન્ડ ચાલી રહ્યો છે.

કચ્છ રીજીયન (પૂર્વ) નાં ipc દ્વારા ડેઈલી વિજેતા ને આપવામાં આવતા રોકડ પુરસ્કાર ઉત્સાહ પૂર્વક અર્પણ કરી રહ્યા છે

આ સુપર ૦૮ રાઉન્ડમાં આઠ ટીમો ની ૦૮ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા લકી ડ્રો કરીને તારીખ ૧૮/૦૨/૨૦૨૪ થી સુપર ૦૮ નો ફ્રેન્ચાઇઝ રાઉન્ડ આજે મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગયેલ છે. જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ ક્રિકેટ રસિકો ની ઉત્સુકતા, જિજ્ઞાસા તેમજ રોમાન્સ ખૂબ જ વધી રહ્યો છે. લોકો ખૂબ જ ઉત્સાહ સાથે મેચ નિહાળવા આવી રહ્યા છે. તેમજ દૂર બેઠેલા ક્રિકેટ રસિકો યુટયુબ ના માધ્યમ થી લાઇવ ક્રિકેટ નો આનંદ માણી રહ્યા છે.

૨૩ તારીખ ના રોજ ટોપની ચાર ટીમ વચ્ચે સેમિફાઇનલ રાઉન્ડ રમવામાં આવશે. તેમજ બીજા દિવસે તારીખ ૨૪ શનિવારના પૂર્ણિમાના દિવસે ભવ્યથી ભવ્ય ફાઈનલ મેચનો મુકાબલો તેમજ સમાપન સમારોહ આયોજીત કરવામાં આવશે.

ત્યારે આ સમારોહમાં મુખ્ય મહેમાન કેશુભાઈ પટેલ ધારાસભ્યશ્રી ભુજ મતવિસ્તાર, મહેન્દ્રભાઈ બગડીયા પોલીસ અધિક્ષકશ્રી (SP) પશ્ચિમ કચ્છ ભુજ, મોહનભાઈ છાભૈયા કુલપતિશ્રી કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી, શ્રીમતી સુલોચનાબેન લીંબાણી ક્લાસ વન ઓફિસર મહિલા અને બાળ વિકાસ અધિકારી - કચ્છ, વડીલ શામજીભાઈ લધાભાઈ ધોળું પરિવાર ટુર્નામેન્ટના મુખ્ય દાતાશ્રી, બહાદુરસિંહ જાડેજા પ્રમુખશ્રી કચ્છ ક્રિકેટ એસોસિએશન તેમજ અતિથિ વિશેષ માં શ્રીસમાજ, માતૃ સંસ્થા, સેન્ટ્રલ યુવાસંઘ, કાઉન્સિલ, ઝોન સમાજ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે.

કચ્છ (પૂર્વ) રીજીયન પ્રવક્તા
પિયુષ લીંબાણી (બિદડા)

કચ્છી માડુ રમેશ દીવાણી ભાજપના લોકસભા ઉમેદવાર બની શકે છે....

મૂળ વતન કચ્છનાં નખત્રાણા તાલુકાનાં વિરાણી ગામનાં હાલે, રાજનાદગાંવ/કબીરધામ ના રમેશ પટેલ પ્રમુખ રહ્યા, ડૉ. રમણસિંહની જીત સુનિશ્ચિત થઈ અને રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર રચાઈ.

તેને માત્ર સંયોગ જ કહી શકાય, આ વખતે પૂર્વ મુખ્યમંત્રી અને રાજનાદગાંવના ધારાસભ્ય ડૉ.રમણસિંહ અત્યાર સુધીમાં સૌથી વધુ મતોથી જીત્યા અને રાજ્યમાં સૌથી વધુ 56 બેઠકો પણ ભાજપને ગઈ. સતત ત્રણ વખત ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરીકે ફરજ બજાવનાર રમેશ દીવાણી હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખ છે.

તેઓ વફાદાર, સ્પષ્ટવક્તા અને સખત મહેનત કરનાર સમર્પિત વ્યક્તિત્વ તરીકે કામદારોની પ્રથમ પસંદગી તરીકે ઓળખાય છે. સંઘના વફાદાર પૂર્ણ-સમયના સ્વયંસેવકથી લઈને એક સામાન્ય કાર્યકર સુધી, તેમણે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ બનીને સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું. રમેશ દીવાણી વર્ષ 2000માં શહેરના જાણીતા ઓલરાઉન્ડર અને ક્રિકેટ ખેલાડી હતા. ઓલરાઉન્ડર અને ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી રમેશ પટેલ 2000માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં કૈલાશ નગર વિસ્તારના કાઉન્સિલર બન્યા હતા.

કોર્પોરેશનના પૂર્વ મેયર સ્વ. વિજય પાંડેના કાર્યકાળ દરમિયાન, તેઓ કાઉન્સિલર રહ્યા અને પાણી, મોટર એન્ફોર્સમેન્ટ અને PWD અધ્યક્ષ રહ્યા. તેઓ ભાજપ વેપારી સેલના શહેર પ્રમુખ હતા અને વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચે સંગઠન મજબૂત કરવાનું કામ કર્યું હતું.

દિગ્વિજય મહાવિદ્યાલય લોકભાગીદારી સમિતિના પ્રમુખપદના કાર્યકાળ દરમિયાન તેમણે કોલેજની દિશા અને દશા બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યાં મોટી ખાનગી કોલેજોમાં લેબ નથી ત્યાં અત્યાધુનિક લેબનું નિર્માણ અને અનેક નવા અભ્યાસક્રમો કોલેજમાં વિષયો શરૂ થયા, જે પોતે ઐતિહાસિક છે.

રાજગામી એસ્ટેટ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે તેમણે લીઝના નિયમોમાં ફેરફાર કરીને લીઝ ધારકોને બોર ખનન પછી લીઝની મુદત લંબાવી અને રાજગામીની મિલકતનો પ્રવાહ વધારવા માટે લીઝ પર આપેલા ખેતરોને ફળદ્રુપ અને ઉપયોગી બનાવવા હકારાત્મક પહેલ કરી હતી.પોતાને કાર્યકર માનતા પટેલે પ્રતિકૂળ સંજોગોમાં સંગઠનને મજબૂત કર્યું.

2004માં યોજાયેલી મેયરની ચૂંટણીમાં તેઓ એકમાત્ર ઉમેદવાર હોત, પરંતુ અનામતને કારણે તેમને તક મળી ન હતી. સ્વ.શોભા સોની જયારે પ્રથમ વખત મેયર બન્યા ત્યારે રમેશભાઇ પટેલના પત્ની રૂક્ષ્મણીબેન પટેલનું નામ મેયર માટે સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ખાસ પરિસ્થિતિમાં નામમાં ફેરફાર કરીને સ્વ.શોભા સોનીનું નામ નક્કી થયું અને તેઓ મેયર બન્યા.

દરેક વર્ગના લોકો સાથે સીધો સંવાદ છે. લોકોને સમયાંતરે સરકારી યોજનાઓનો લાભ આપવાથી માંડી, તબીબી સારવારમાં સહાય પૂરી પાડવાથી માંડીને ગરીબો અને વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક મદદ કરવા સુધી, તેઓ દરેક પરિસ્થિતિમાં શ્રમિકો માટે હંમેશા ઊભા છે.

'પહેલા સંગઠન, પછી પક્ષ, મેં ક્યારેય કોઈ હોદ્દા માટે આકાંક્ષા નથી' ની કહેવત પર જીવી રહેલા રમેશ પટેલે પક્ષ દ્વારા તેમને જે કંઈપણ આપવામાં આવ્યું તે ખૂબ જ જવાબદારી સાથે સંભાળ્યું.

આ રીતે અનેક જવાબદારીઓ નિભાવતા આજે રાજનાંદગાંવ અને કબીરધામના લોકો કહી રહ્યા છે કે, જો ભાજપ રમેશ દીવાણી પટેલને તક આપશે, તો ચોક્કસપણે શ્રી મોદીનું મિશન દરેક માટે સફળ થશે. સાથે મળીને, દરેકનો વિશ્વાસ મજબૂત થશે, અને અમે મોદીની ગેરંટી છેલ્લી વ્યક્તિ સુધી લઈ જવાનું કામ કરીશું..

ચિપલુણ તાલુકા સમાજમાં રમતોત્સવનું ભવ્ય આયોજન (DMG)

દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા રીજીયન પરશુરામ ડિવીઝન ચિપલુણ તાલુકા સમાજની ત્રણેય પાંખો દ્વારા તા.૧૯/૦૨/૨૦૨૪, સોમવારના રોજ ચિપલુણ તાલુકા યુવાસંઘ દ્વારા રમત-ગમત ટુર્નામેન્ટસ-૨૦૨૪ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મેન્સ વોલીબોલ લીગ અને વુમન્સ ક્રિકેટ લીગ-૨૦૨૪ નું આયોજન શ્રી કોંકણ ટીમ્બર, MIDC ખેર્ડી મુક્કામે કરવામાં આવેલ. આ રમત-ગમત ટુર્નામેન્ટસ અંતર્ગત મેન્સ વોલીબોલની ૦૪-ટીમ અને વુમેન્સ ક્રિકેટની ૦૪-ટીમ સહભાગી થયેલ. કાર્યક્રમની શુભ શરૂઆત સમાજની ત્રણેય પાંખોના ઉપસ્થિત હોદ્દેદાર શ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ તેમજ પ્રસંગ અનુરૂપ ઉદબોધન બાદ રમતોત્સવની શરૂઆત કરેલ.

લીગ ફોર્મેટ અંતર્ગત ભરપુર ઉત્સાહ અને ખેલદિલી સાથે આ રમત-ગમત ટુર્નામેન્ટસને ભવ્યાતિભવ્ય રીતે પાર પાડવામાં આવેલ.સમાજના સર્વે સભ્યોએ મોટી સંખ્યામા ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારેલ તેમજ રમત-ગમતનો આનંદ મેળવેલ. કાર્યક્રમનું સફળ આયોજન સ્પોર્ટસ કન્વીનર મોહિત ધોળું, અરવિંદ પોકાર, મીનાબેન લીંબાણી તેમજ ફંડ રાઈઝિંગ કન્વીનર અમિત ધોળું, અશ્વિન વાસાણી, ભરત છાભૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ: અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખેડૂતો, મહિલાઓથી ભરાવા લાગ્યું, ગીતા રબારીના 'શ્રીરામ પ્રભુજી ઘર આયે'ના ગીત પર લોકો ઝુમ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવવાના છે. સવારે 10:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચશે. ત્યારબાદ 10.45 વાગ્યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપશે.

જેને લઈ વહેલી સવારથી જ ખેડૂતો સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી ખેડૂતો વડાપ્રધાનના કાર્યક્રમમાં પહોંચી રહ્યા છે. સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહારના ભાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લોકોથી ભરાવા લાગ્યું છે.

PMના આગમન સમયે રાજકોટના 14 માર્ગ રહેશે બંધ:શનિવારે અને રવિવારે કાર્યક્રમ દરમિયાન આ રસ્તાઓ રહેશે બંધ, પાર્કિંગ સ્થળ જાહેર કરાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.

તેમના આગમન પૂર્વે રાજકોટના કેટલાક માર્ગો પર પ્રવેશબંધીને લઈને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં 14 માર્ગો પર વાહન પ્રવેશ નહીં કરી શકે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આગલા દિવસે એટલે કે, 24 ફેબ્રુઆરીના રોજ જૂના એરપોર્ટથી સભા સ્થળ સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવશે જેથી એ દિવસે બપોરના 11 થી સાંજના 5 વાગ્યા સુધી રસ્તા બંધ રહેશે. જેની સામે વૈકલ્પિક રસ્તાઓ પણ આપવામાં આવ્યા છે.

રાજકોટ પોલીસ કમિશનરે માર્ગો પર પ્રવેશબંધીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. રવિવારે 11 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી 14 જેટલા રસ્તાઓ બંધ રહેશે.

દિનાંક ૨૨/૨/૨૦૨૪ ને ગુરુવાર ના રોજ પુષ્ય નક્ષત્ર છે. બાળકોને સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાના છે

અવસાન નોંધ

તારીખ 22/2/2024
સ્વઃ માનબાઈ વેલજીભાઈ રંગાણી
ઉંમર વર્ષ:102, કચ્છમાં ગામ ગઢશીશા
(MDV) (સ્થાનિક)

તારીખ 21/02/2024
સ્વઃ નરોત્તમભાઈ ચુનીલાલ ભીમાણી
ઉંમર વર્ષ:42, કચ્છમાં ગામ આણંદપર
(યક્ષ) હાલે, નખત્રાણા (કચ્છ)

સ્વઃ ચંદુલાલ રામજીભાઈ ભાવાણી
ઉંમર વર્ષ :45, કચ્છ માં ગામ ખીરસરા
(નેત્રા) હાલે ચિખોદરા (આણંદ)